



**વડોદરા મહાનગરપાલિકા**  
**આરોગ્ય વિભાગ**

**તદ્દન હંગામી ધોરણે ૧૧ માસ કરાર આધારિત ઈસમો લેવા અંગેની જાહેરાત**  
**(પી.આર.ઓ. જાહેરાત ક્રમાંક: ૨૬૦/૨૦૧૮-૧૯)**

ક્રમ	જગ્યાનું નામ	જગ્યાની સંખ્યા	કેટેગરી (રોસ્ટર પોઇન્ટ)	ખાલી જગ્યા પેકી શારીરીક ખોડખાંપણવાળા ઉમેદવારો માટે
૧	ફિલ્ડ વર્કર (પુરૂષ)	૩૮૪	અ.જા. - ૨૬ અ.જ.જા. - ૫૭ સા.શૈ.પ.વ. - ૧૦૩ બિન અનામત - ૧૯૮	૧૧

**(૧) શૈક્ષણિક લાયકાત તથા અનુભવ:**

- (૧) ઓછામાં ઓછું ધોરણ: ૮ પાસ
- (૨) સાયકલ ચલાવતાં આવડવું જોઈએ.
- (૩) આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતાં ઉમેદવારને પ્રાધાન્ય.
- (૪) વડોદરા શહેરના ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.

**(૨) માસિક મહેનતાણુ:** માસિક રૂ.૭,૧૦૦/- (ઉચ્ચક)

**(૩) ઉંમર:** જાહેરાતની તારીખે ૩૦ વર્ષથી વધુ નહીં.

વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદવારો માટે જાહેરાતની તારીખે ૫૯ વર્ષથી વધુ નહીં.

**(૪) નિમણૂકની મુદ્દત:** તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત.

આરોગ્ય વિભાગના વાહકજન્ય તથા પાણીજન્ય રોગ નિયંત્રણલક્ષી ક્ષેત્રીય કામગીરી માટે તદ્દન હંગામી  
ઘોરણો ૧૧ માસ કરાર આધારિત ઇસમો લેવા અંગેની જાહેરાત

જાહેરાતની સામાન્ય શરતો

1. ઉપર જણાવેલ જગ્યા માટે ઉમેદવારી કરતાં પહેલાં ઉમેદવારે પોતે જરૂરી પાત્રતા ધરાવે છે કે નહીં તેની ખાત્રી કરવી.
2. રસ ધરાવતા ઉમેદવારોએ તા.૩૦/૦૬/૨૦૧૮ (૧૧-૦૦ કલાક) થી તા.૦૬/૦૭/૨૦૧૮(૨૩-૫૯ કલાક) દરમિયાન [www.vmc.gov.in](http://www.vmc.gov.in) વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરતાં પહેલાં જરૂરી માહિતી તેમજ સુચનાઓ [www.vmc.gov.in](http://www.vmc.gov.in) ઉપરથી વાંચી લેવાની રહેશે.
3. **શૈક્ષણિક માહિતી:** જે ઉમેદવાર માત્ર ઘોરણ-૮ પાસ હોય તેઓએ **education qualification details** માં **“Add More” Option** પર પાંચ(૦૫) વખત **Click** કરી **OTHER-1** આવે તેમા વિગતો ભરવાની રહેશે.
4. **અનામત:** ગુજરાત સરકારશ્રી દ્વારા માન્ય કરેલ હોય તેવા અનુ.જાતિ, અનુ.જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને જ અનામતનો લાભ મળવાપાત્ર રહેશે આ અંગે ગુજરાત રાજ્યના સક્ષમ અધિકારીશ્રી દ્વારા ઇશ્યુ કરાયેલ જાતિ અંગેનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે.
5. **વયમર્યાદા:** જાહેરાતની તારીખે ૩૦ વર્ષથી વધુ નહીં વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રીય ફરજ બજાવેલ ઉમેદવારો માટે જાહેરાતની તારીખે ૫૯ વર્ષથી વધુ નહીં.
6. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોવા અંગેનું સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તા.૦૯-૦૨-૧૯૯૬ ના ઠરાવ થી નિયત થયેલ પરિશિષ્ટ-ક ના નમુનામાં નાણાકીય વર્ષ-૨૦૧૬-૧૭ નું તા.૧/૪/૨૦૧૬ પછીનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
7. ઉમેદવારે નિયત અરજી પત્રકમાં ભરેલ વિગતો સમગ્ર પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવાઓ કચેરી દ્વારા માંગવામાં આવે ત્યારે અસલમાં રજુ કરવાના રહેશે અન્યથા અરજીપત્રક જે તે તબક્કે રદ ગણવામાં આવશે.
8. ઉમેદવારે અરજીમાં દર્શાવેલ કેટેગરીમાં પાછળથી કેટેગરી બદલવાની રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.
9. ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી જગ્યાને અનુરૂપ C C C લેવલનો કોમ્પ્યુટર કોર્સ અવશ્ય પાસ કરેલ હોવો જોઈએ.

10. પ્રક્રિયા દરમ્યાન જો કોઈ ઉમેદવાર દ્વારા સીધી અથવા આડકતરી રીતે રાજકીય કે અન્ય કોઈ રીતે ભલામણના પ્રયાસ કરનાર ઉમેદવાર ગેરલાયક ઠરશે.
11. ઉમેદવારે અરજી પત્રકમાં કોઈ પણ વિગત ખોટી બતાવેલ હશે અને તે ધ્યાનમાં આવશે તો તેનું અરજીપત્રક/નિમણુંક કોઈ પણ તબક્કે રદ કરવામાં આવશે.
12. આ જાહેરાત અન્વયેની આગળની પ્રક્રિયા અંગે લેખિત પરિક્ષા/મૌખિક ઈન્ટરવ્યુ બાબતે વડોદરા મહાનગરપાલિકા ના સક્ષમ અધિકારીશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવશે.
13. પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી/લેખિત/મૌખિક કસોટી માટે બોલાવવામાં આવતા ઉમેદવારોને કોઈપણ જાતનું મુસાફરી ભથ્થુ મળવા પાત્ર થશે નહીં.
14. આ જાહેરાત કોઈ પણ કારણસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેમ કરવાનો સંપૂર્ણ હક્ક/અધિકાર મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, વડોદરા ને રહેશે.
15. ઉમેદવારને ઓનલાઇન અરજી કર્યા બાદ જાહેરાત સંબંધી અન્ય કોઈ સુચના માટે [www.vmc.gov.in](http://www.vmc.gov.in) વેબસાઇટ સતત જોતા રહેવા અનુરોધ છે.

તા. ૨૮-૦૬-૨૦૧૮.

ડે.મ્યુનિ.કમિશ્નર  
વડોદરા મહાનગરપાલિકા